

રાણી દ્વારા સન્માનિત મહાનુભાવો

લંડન: શનિવારે રાણી એલિઝાબેથ-ટુના જન્મદિને વિવિધ એવોર્ડ પ્રાપ્ત કરનારાઓના નામ જાહેર થયા હતા.

નાઈટ્સ બેચલર નાઈટહૂડ્સ પ્રોફે. સબારત્નમ અરુલકુમારન, પ્રેસિડન્ટ: રોયલ કોલેજ ઓફ ઓબ્સ્ટ્રિસિયન્સ એન્ડ ગાયનેકોલોજીસ્ટ્સ.

ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર કમાન્ડર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર

૧. ડો. અનાસ અલ-શેખ અલી, એકેડેમિક એડવાઈઝર, લંડન ઓફિસ

૨. નરેન્દ્ર બજરીયા, શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે સેવા બદલ, શેફિલ્ડ, સાઉથ યોર્કશાયર

૩. રુમી વેરજી, ચેરીટેબલ સર્વિસીઝ બદલ

ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર ઓફિસર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર

૧. મિસિસ ગુરદેવ કૌર અબરોલ, વેસ્ટ મિડલેન્ડ્સમાં એશિયન અને શીખ મહિલાઓની સ્વૈચ્છિક સેવા બદલ.

૨. રેશાર્દ શેખ મહમદ ઓલાદિન, ડેપ્યુટી ચેરમેન મેટ્રોપોલિટન ઓથોરિટી.

૩. રોખસાના ફિઆઝ, ડિરેક્ટર, ચેન્જ ઇન્સ્ટીટ્યૂટ, બ્લેક અને એથનિકની સેવા બદલ.

૪. ફિયાઝ મુઘલ, ડિરેક્ટર, ફેઈથ મેટર્સ, સ્વૈચ્છિક ક્ષેત્રે સેવા બદલ

ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર મેમ્બર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર

૧. મિસિસ. જામિલા આફતાબ, સેન્ટ પોલ, બ્રિસ્ટલમાં કમ્યુનિટી સેવા બદલ,

૨. અશુક એહમદ, યુવાનોના ક્ષેત્રે સેવા બદલ, લૂટન

૩. સાયેદા રોવગી બેગમ, બંગાળી અને સોમાલી લોકોના ક્ષેત્રે સેવા બદલ, એસેક્સ.

૪. કુલજિત ભામરા, ભાંગડા અને બ્રિટિશ એશિયન મ્યુઝિક ક્ષેત્રે કાર્ય બદલ

૫. ડો. શોભા દાસ, ડેપ્યુટી ડિરેક્ટર, સપોર્ટ અગેઈનસ્ટ રેસિસ્ટ ઇન્સીડન્ટ્સ.

૫. કંવરજિતસિંઘ ધિલ્લોન, ફોરેન્સિક ઓપરેશન્સ મેનેજર,

બેકફીશાયર પોલીસ.

૬. ગુદુરુ ગોપાલ રાવ, કન્સલટન્ટ માર્કેટિંગ/લોજિસ્ટિક્સ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ.

૭. કામિની ગધોક, ચીફ એક્ઝિક્યુટિવ એન્ડ પ્રોફેશનલ ડિરેક્ટર, રોયલ કોલેજ ઓફ સ્પીચ એન્ડ લેંગ્વેજ થેરાપીસ્ટ્સ, હર્ટફોર્શાયર.

૮. કેથરીન સુસાન ગેલવીન, એડોપ્શન કોન્ક્રેટ કો-ઓર્ડિનેટર, ડેવોન કાઉન્ટિ કાઉન્સિલ.

૯. નીના રાજારાણી ગાંગુલી, સાઉથ એશિયન ડાન્સ ક્ષેત્રે સેવા બદલ.

૧૦. કાઉન્સિલર અહમદુલ હક, ચેરમેન-અલ ઇસ્લાહ કોમ્યુનિટી ટ્રસ્ટ.

૧૧. ઈફતેખાર હુસૈન, ડરહામમાં એશિયન લોકોની સેવા બદલ.

૧૨. નુરુલ ઇસ્લામ, બંગાળીઓની સેવા બદલ.

૧૩. ઈબ્રાહિમ ખરોડિયા, સેન્ટ્રલ લંડનમાં ફાર્મસી અને મલાવીમાં ચેરીટી બદલ.

૧૪. મિસ. સાફિયા લૈલા મિન્ની, સ્થાપક અને ડિરેક્ટર, પીપલ ટ્રી.

૧૫. મિસિસ. લોપા પટેલ, સ્થાપક-રેડ હોટકરી.કોમ અને સર્જનાત્મક ઉદ્યોગ ક્ષેત્રે સેવા બદલ. હેટફિલ્ડ, હર્ટફોર્શાયર.

૧૬. મિસિસ. પ્રવિણા પટેલ, લંડનમાં સ્વૈચ્છિક રીતે પીડિતોને સહયોગ અને સાક્ષીઓની કાળજી રાખવા બદલ. સાઉથ ડુઈસ્લીપ, મિડલસેક્સ.

૧૭. મિસિસ. ઉર્વશી પટેલ, સીનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર, એડલ્ટ બેઝિક સ્કીલ્સ સ્ટ્રેટેજી યુનિટ, ડીપાર્ટમેન્ટ ફોર ઇનોવેશન, યુનિવર્સિટી ઓફ સ્કીલ્સ. જાહેર અને સ્વૈચ્છિક સેવા બદલ, લંડન.

૧૮. અવતારસિંઘ સંધુ, નોર્થ વેસ્ટ કેન્ટમાં કોમ્યુનિટી સર્વિસ બદલ.

૧૯. મિસ. ગીતી સિંઘ, સ્થાપક-ડ્યુક ઓફ કેમ્બ્રિજ. ઓર્ગેનિક ગેસ્ટ્રોપબ ટ્રેડ ક્ષેત્રે સેવા બદલ.

૨૦. મિસ. સંગીતા એલિઝાબેથ સિંઘ, સ્થાપક-ડ્યુક ઓફ કેમ્બ્રિજ. ઓર્ગેનિક ગેસ્ટ્રોપબ ટ્રેડ ક્ષેત્રે સેવા બદલ.

૨૧. કાઉન્સિલર મંજૂલા પી.સુદ, લેસ્ટરમાં કોમ્યુનિટી સર્વિસ બદલ.

ઉર્વશીબેન પટેલને મહારાણીનો MBE એવોર્ડ એનાયત

સાઉથ લંડનના ટૂટીંગ ખાતે રહેતા અને મૂળ સોજીત્રાના વતની શ્રીમતી ઉર્વશીબેન (મીતા) રણજીતકુમાર પટેલને પબ્લીક અને વોલંટરી સર્વિસ માટે મહારાણી તરફથી તેમના જન્મ દિને મેમ્બર ઓફ બ્રિટિશ એમ્પાયર (MBE) એવોર્ડ દ્વારા નવાજેશ કરવામાં આવ્યા છે. ઉર્વશીબેન હાલમાં ડીપાર્ટમેન્ટ ફોર ચિલ્ડ્રન, સ્કૂલ્સ અને ફેમિલીઝમાં સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે સેવા આપે છે.



ઉર્વશીબેનનો જન્મ ધર્મજમાં થયો હતો અને બાળપણ યુગાન્ડા - ભારતમાં વિતાવ્યું હતું. ૧૯૭૪માં તેઓ પરિવાર સાથે યુકેમાં સ્થાયી થયા હતા અને પોતાનું શિક્ષણ પૂર્ણ કરી ૧૯૭૭માં સિવિલ સર્વિસીસમાં જોડાયા હતા. ઉર્વશીબેન અત્યાર સુધીમાં ચાર અલગ અલગ સરકારી વિભાગમાં સેવા આપી ચૂક્યા છે.

તેમણે સાઉથ લંડન વિસ્તારમાં અપંગ લોકો સહિત યુવાનો અને પરિવારો માટે સેવા આપી હતી. ૨૦૦૧થી તેઓ રાષ્ટ્રીય સ્તરે કામ કરે છે અને બાળકો, યુવાનો અને પરિવારોને મદદરૂપ થતી શિક્ષણ, નોકરી

અને અપંગતા વિષયક સરકારની મહત્વની નીતિઓ ઘડવામાં અગત્યનો ભાગ ભજવે છે.

આ ઉપરાંત ઉર્વશીબેને પતિ રણજીતકુમાર પટેલ અને પોતાના સાથીઓ સાથે મળીને વિવિધ સેવા કાર્યો

ગુજરાતમાં કર્યા છે. જેમાં શાળાઓને મદદ કરી છે અને જાહેર અને ખાનગી ક્ષેત્રના સહકારથી વિવિધ પ્રોજેક્ટ્સને પૂર્ણ કર્યા છે. ઉદાહરણ તરીકે ઉર્વશીબેન અને તેમના વિભાગના બે સાથીઓએ મળીને ધર્મજની ખાનગી ઈંગ્લીશ સ્કૂલમાં ૩ સપ્તાહના કાર્યશીબીરનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે સ્થાનિક શિક્ષકો સાથે મળીને યુકેની શિક્ષણ પદ્ધતી અને રીતભાતથી સ્થાનિક શિક્ષકોને માહિતગાર કરી બાળકોને યુકેના સ્તરનું અંગ્રેજીનું શિક્ષણ મળે તે માટે તેઓ મદદરૂપ થયા હતા.

ઉર્વશીબેનના પતિ રણજીતભાઈ

હોમઓફીસમાં છેલ્લા ૧૮ વર્ષથી કામ કરે છે અને તેઓ પણ ઉર્વશીબેનના સમાજસેવાના જે તે કાર્યોમાં પ્રોજેક્ટ હેડ તરીકે મદદ કરે છે.

છેલ્લે ઉર્વશીબેન તેમના વિભાગના સાથી કર્મચારીઓ, મિત્રો અને સ્વજનો પાસેથી ફંડ એકત્રીત કરીને ખંભાત પાસે આવેલા કોડવા ગામની પ્રાથમિક શાળાના પુનઃનિર્માણનું કાર્ય કર્યું હતું. તેમણે એક નવો ક્લાસરૂમ પણ બંધાવી આપ્યો હતો અને રંગરોગાન, શાળાને જરૂરી એવી બેન્ચિસ, ફર્નીચર, રમકડા, મ્યુઝીક સીસ્ટમ, વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ્સ, પુસ્તકો નોટબુક તેમજ અન્ય સ્ટેશનરી વગેરેની પણ મદદ કરી હતી. આ ઉપરાંત યુકેની વિવિધ કંપનીઓ દ્વારા ભેટ અપાયેલ સ્કૂલ બેગ્સ, સ્ટેશનરી અને અન્ય આઈટમો તેમણે સોજીત્રા ગામની શાળાના બાળકોને ભેટ આપ્યા હતા. આ ઉપરાંત તેમણે અપંગો માટેની બોર્ડિંગ સ્કૂલને ગોદડા તેમજ નર્સરીના બાળકોને રમકડા ભેટ આપ્યા હતા.

તેમના માતા ઇન્દુબેન તથા પિતા સ્વ. કનુભાઈ એમ. પટેલ નડિયાદના વતની છે. ઉર્વશીબેનને તેમની આ સફળતા બદલ તેમના દિકરી જલ્પા, જમાઈ દિપેશ અને દિકરા પ્રિતેશ સહિત મિત્રો, પરિવારજનોએ અભિનંદન આપ્યા હતા.

Tours to EUROPE
(09 to 14 Days)

Tours to the AMERICAS
(06 to 20 Days)

CHINA with HONG KONG
(12 Days)

Best of EGYPT
(09 Days)

• Indian meals on all tours • Professional Tour Managers. • All inclusive tours • Transparent Tour Programs

Head Office (U.K.):
312, Harrow Road, Wembley, Middlesex HA9 6LL.
Tel.: (+44) 020 8900 2323 • Fax: (+44) 020 8903 6380
E-mail: info@startours.co.uk

Leicester Office (U.K.):
115A, Belgrave Road, Leicester, LE4 6AS.
Tel.: (+44) 011 6266 0800 • Fax: (+44) 011 6266 1700
E-mail: leicester@startours.co.uk

India - Office:
205, Kedia Chambers, 2nd Floor, S.V. Road, Malad (West),
Mumbai - 400064. Tel.: (+91) 022-2888 1131 / 32 / 33
Email: india@startours.co.uk

www.startours.co.uk

કેનેડિયન લેખિકાને બૂકર પ્રાઈઝ

લંડન: ટૂંકી વાર્તાઓના ખ્યાતનામ કેનેડિયન લેખિકા એલિસા મુનરોએ જાણીતા બંગાળી લેખિકા મહાશ્વેતાદેવી અને નોબેલ પુરસ્કૃત ભારતીય મૂળના લેખક વી. એસ. નાયપોલને પાછળ રાખીને આ વર્ષનું મેન બૂકર ઇન્ટરનેશનલ પ્રાઈઝ જીત્યું છે, જેમાં ૬૦,૦૦૦ પાઉન્ડના પુરસ્કારનો સમાવેશ થાય છે. ૭૭ વર્ષીય મુનરો ૨૦૦૫માં શરૂ થયેલો અને દર બે

વર્ષે એનાયત કરાતો આ પુરસ્કાર જીતનારી ત્રીજી વ્યક્તિ છે. અગાઉ અલ્બાનિયામાં ઇસ્માઈલ કડારે અને નાઈજીરિયામાં ચિનુઆ અચેબે બૂકર પ્રાઈઝથી સન્માનિત થઈ ચૂક્યા છે. હયાત લેખક-લેખિકાએ સાહિત્યક્ષેત્રે આપેલા પ્રદાનની કદરરૂપે અને તેમની સર્જનાત્મકતાને વૈશ્વિક સ્તરે આગળ લાવવાના હેતુથી અપાતા આ પુરસ્કાર માટે કુલ ૧૩ સર્જકોની પસંદગી થઈ હતી.